

20th July, 2024

To,

Dept. of Corporate Services,

BSE Limited,

Phiroze Jeejeebhoy Towers,

Dalal Street,

Mumbai - 400 001

BSE Scrip Code: 533161

To,

The Listing Department,

National Stock Exchange of India

Limited,

Exchange Plaza, Bandra Kurla Complex,

Bandra (East),

Mumbai - 400 051

**NSE Symbol: EMMBI** 

Sub: Newspaper Publication - Notice of Extra-Ordinary General Meeting and Remote E-voting information

Dear Sir/Madam,

Pursuant to Regulation 30 and Regulation 47 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015, please find attached herewith copy of Newspaper Publications in 'Financial Express' (English) & 'Financial Express' (Gujarati) newspapers dated 20th July, 2024, in respect of Notice convening the Extra-Ordinary General Meeting of the Company, scheduled to be held on Tuesday, 13th August, 2024 at 11:30 am (IST) through Video Conferencing / Other Audio Visual Means alongwith information on Remote E-voting and other related information.

The copy of the said publication is also being made available on the website of the Company at www.emmbi.com.

We request you to take the information on your records.

Thanking you,

Yours faithfully,

For Emmbi Industries Limited

Rinku Appalwar

Executive Director and CFO
(DIN:00171976)

Encl.: As above

## ADVERTISEMENT OF NOTICE OF RECORD DATE FOR CONSOLIDATION OF EQUITY SHARE CAPITAL OF ASSOCIATED MARMO AND GRANITES LIMITED

A petition under Section 61(1)(b) of the Companies Act, 2013, for Consolidation of Shares was presented by Associated Marmo and Granites Limited, in August 2021, and the said petition was approved by the Hon'ble Nationa Company Law Tribunal, Jaipur bench vide its order dated May 22, 2024 (certified copy received on May 28). The Board of Directors of the Company has at its meeting held on 13th, July, 2024, has determined 6th August, 2024, which is the Record Date, fixed for the purpose of consolidation of equity shares of the Company from Rs. 10/- each into Rs. 12,10,000/- each.

The above information is also available on the website of the Company (www.amgl.in).

For Associated Marmo and Granites Limited

Date: 19th July, 2024 Place: Pasoond, Rajsamand

Nishant Bagla Managing Director

Registered Office: N H 8, Pasoond, Rajsamand - 313326 Email: nbagla1@hotmail.com Website: www.amgl.in CIN: U14101RJ1980PLC001989

ZIM LABORATORIES LIMITED

## CIN: L99999MH1984PLC032172

Registered Office: Sadoday Gyan (Ground Floor), Opp. NADT, Nelson Square, Nagpur - 440 013, Maharashtra, India. Website: www.zimlab.in, e-mail: cs@zimlab.in Telephone No.: Registered Office: 0712-2981960, Works Office: 07118-271990

## NOTICE

### Transfer of Equity Shares of the Company to Investor **Education and Protection Fund (IEPF) Authority**

Notice is hereby given that pursuant to the provisions of Section 124 of the Companies Act, 2013 (the Act), read with the Investor Education and Protection Fund Authority (Accounting, Audit, Transfer and Refund) Rules, 2016 (the Rules). as amended, the Equity Shares of the Company, in respect of which the dividend has remained unclaimed or unpaid for a period of seven consecutive years or more, are required to be transferred by the Company to the demat account of the IEPF Authority.

The Company has sent individual notices to the concerned shareholders who have not claimed dividend for seven consecutive years starting from the Financial Year 2016-17 at their registered addresses, whose shares are liable to be transferred to the IEPF Authority, advising them to claim their unclaimed dividends. The Company has uploaded details of the concerned shareholders whose shares are due for transfer to the IEPF Authority on its website www.zimlab.in. Shareholders are requested to refer to the said website to verify the details of unclaimed dividends and the shares which are liable to be transferred to the IEPF Authority.

The concerned shareholder(s) holding shares in physical form, and whose shares are liable to be transferred to the IEPF Authority, may note that upon transfer of shares to IEPF Authority, the original share certificate(s) registered in their name will stand automatically cancelled and be deemed non-negotiable. The Shareholders may further note that the details uploaded by the Company on its website shall be deemed adequate notice in respect of issue of New Share Certificate(s) by the Company for the purpose of transfer of Shares to the Account of IEPF pursuant to the said Rules. In respect of shares held in demat form, necessary Corporate Action shall be initiated by the Company for the transfer of Shares to demat account of the IEPF as per the Rules.

In case the concerned shareholders do not claim their unclaimed dividends by 20.10.2024, the Company shall, with a view to complying with the Rules, transfer the shares to the IEPF Authority without any further notice to the shareholders, and no liability shall lie against the Company in respect of the shares so transferred.

The shareholders may note that upon transfer of the shares to IEPF Authority. including all benefits accruing on such shares, if any, the same can be claimed only from the IEPF Authority by making a separate application to the IEPF Authority in Form IEPF-5 as prescribed under the Rules. This form is made available on the IEPF website i.e. www.iepf.gov.in. For any gueries in respect of the above matter shareholders may contact our RTA Link Intime India Pvt. Ltd., C-101, 247 Park. LBS Marg, Vikhroli (West), Mumbai - 400083, Tel No.: (022) 49186270, e-mail: iepf.shares@linkintime.co.in For ZIM Laboratories Limited

(Piyush Nikhade)

Company Secretary

: 19.07.2024

Place : Nagpur

Date

CIN: L17120DN1994PLC000387

Regd. Off.: 99/2/1 & 9, Madhuban Industrial Estate. Madhuban Dam Road Rakholi Village, U.T. of Dadra & Nagar Haveli, Silvassa - 396230. Tel: +91(0260) 320 0948, Fax: +91 22 4979 0304 E-mail: info@emmbi.com, Website: www.emmbi.com **NOTICE OF EXTRA ORDINARY GENERAL** 

# **MEETING AND REMOTE E-VOTING INFORMATION**

Notice is hereby given that the Extra Ordinary General Meeting ('EGM') of the Members of Emmbi Industries Limited will be held on Tuesday, 13<sup>t</sup> August, 2024 at 11:30 a.m. (IST) through Video Conferencing ('VC')/ Other Audio Visual Means ('OAVM') Facility, to transact the business as stated in the Notice of EGM.

In compliance with all the applicable provisions of the Companies Act, 2013 ('the Act') and the Rules made thereunder and the Securities and Exchange Board of India ('SEBI') (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015 read with the General Circular No. 11/2022 dated December 28, 2022 and General Circular No. 09/2023 dated September 25, 2023 issued by Ministry of Corporate Affairs (collectively referred as 'MCA Circulars') and SEBI Circular No. SEBI/HO/CFD/PoD-2/P/CIR/ 2023/4 dated January 5, 2023 and SEBI/HO/CFD/CFD-PoD-2/P/CIR/2023/167 dated October 7, 2023 (collectively referred as 'SEBI Circulars'), permitted the holding of EGM through VC/OAVM, without the physical presence of the Members at a common venue. Members will be able to attend the EGM through VC/ OAVM or view the live webcast at https://www.evoting.nsdl.com. Members participating through VC/OAVM facility shall be reckoned for the purpose of quorum under section 103 of the Act.

The Notice of the EGM is being sent only by electronic mode to those Shareholders whose email addresses are registered with the Company Registrar and Share Transfer Agents/Depository Participants, in accordance with the aforesaid MCA Circulars and SEBI Circulars. The Notice of the EGM will also be available on the website of the Company at www.emmbi.com, websites of BSE Limited and National Stock Exchange of India Limited i.e. at www.bseindia.com and www.nseindia.com respectively and the website of National Securities Depository Limited (NSDL) at https://www.evoting.nsdl.com.

It is further informed that the Company has completed the Dispatch of the

Notice of the EGM on  $19^{\text{th}}$  July, 2024. Pursuant to provisions of section 108 of the Act and rule 20 of the Companies

(Management and Administration) Rules, 2014, as amended, and Regulation 44 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015, members holding shares in physical or dematerialized form, as on the cut-off date, i.e., Tuesday, 6th August, 2024, may cast their vote electronically on the business, as set out in the Notice of the EGM through e-voting platform of NSDL by launching the URL https://www.evoting.nsdl.com, as the Company has engaged the e-voting services from NSDL. The detailed procedure/instructions for e-voting are contained in the Notice of EGM of the Company.

In this regard, the members are hereby further notified that: a) Remote e-voting shall commence from Friday, 9th August, 2024 at 9:00

a.m. (IST) and ends on Monday, 12th August, 2024 at 5:00 p.m. (IST). During this period, Members may cast their vote electronically. The remote e-voting module shall be diabled by NSDL thereafter. b) Cut-off date for the purpose of remote e-voting and voting at the EGM is

Tuesday, 6<sup>th</sup> August, 2024.

Place : Mumbai

Date : 19<sup>th</sup> July, 2024

c) Any person who acquires shares of the Company and becomes member of the Company after dispatch of the Notice of EGM and holding shares as of the cut-off date i.e., Tuesday, 6th August, 2024, may obtain the login ID and password by sending request email to evoting@nsdl.co.in, however, if he/she is already registered with NSDL for remote e-voting then he/ she can use his/her existing user ID and Password for casting their vote(s).

d) Members present at the meeting through VC/OAVM and who had not cast their votes on the resolution through remote e-voting and are otherwise not barred from doing so, shall be eligible to vote through evoting system during the EGM. The instructions for attending the EGM through VC/OAVM are provided in the Notice of the EGM.

e) Members who have cast their votes by remote e-voting prior to the EGM may also attend/ participate in the EGM through VC/OAVM facility, but shall not be allowed to cast their votes again at the EGM.

) A person whose name is recorded in the register of members or in the register of beneficial owners, maintained by the depositories as on the cut-off date only shall be entitled to avail of the facility of remote e-voting as well as e-voting during the EGM.

g) In case of any queries relating to e-voting, members may refer the Frequently Asked Questions ('FAQs') and e-voting manual available at https://www.evoting.nsdl.com or contact Ms. Pallavi Mhatre, Senior Manager, National Securities Depository Limited, Trade World, A Wing, 4th & 5th Floors, Kamala Mills Compound, Lower Parel, Mumbai, Maharashtra - 400 013 or can call on 022 - 4886 7000 or can send a email request to evoting@nsdl.com.

The Board of Directors of the Company have appointed Mr. Sanjay Dholakia, Practicing Company Secretary (PCS No. 1798) of M/s. Sanjay Dholakia & Associates, Company Secretaries, as the Scrutinizer to scrutinize the remote e-Voting process and voting through e-Voting system at the EGM in a fair and transparent manner.

> By order of the Board, For Emmbi Industries Limited Rajesh Solanki **Company Secretary**



#### TATA POWER (Corporate Contracts Department)

The Tata Power Company Limited, Smart Center of Procurement Excellence, 2" Floor, Sahar Receiving Station, Near Hotel Leela, Sahar Airport Road, Andheri East, Mumbai-400059 (Board Line: 022-67173188) CIN: L28920MH1919PLC000567

#### NOTICE INVITING TENDER The Tata Power Company Limited invites tenders for self / its subsidiaries, from eligible

vendors for the following package (Two Part Bidding). 1) 4100035166/CC25ADO012: Outline Agreement (OLA) for 1 year for Supply

Installation and AMC of EV Chargers in Mumbai. Last date for Bid Submission: 12" August 2024, 3:00 PM

For detailed NIT, please visit Tender section on website https://www.tatapower.com Also, all future corrigendum's if any, to the said tender will be informed on Tender section

# **BONDADA ENGINEERING LIMITED** CIN: U28910TG2012PLC080018

on website https://www.tatapower.com.only.

Regd. Office: 1-1-27/37, Ashok Manoj Nagar, Kapra, Hyderabad, Telangana - 500 062, India Contact: 7207034662, Email: cs@bondada.net, Website: www.bondada.net

## NOTICE OF ANNUAL GENERAL MEETING AND INFORMATION REGARDINGE-VOTING

Notice is hereby given that the 12th Annual General Meeting ("AGM") of the Company will be held on Monday, August 12, 2024 at 3.00 p.m. IST through Video Conferencing (VC) or Other Audio Visual Means (OAVM), in compliance with the applicable provisions of the Companies Act, 2013 and in compliance with the procedure prescribed in circular nos. 14/2020, 17/2020, 22/2020, 33/2020, 39/2020, 10/2021 20/2021, 03/2022, 11/2022, 09/2023 ( "MCA Circulars") issued by the Ministry of Corporate Affairs ("MCA") and circular nos. SEBI/HO/CFD/CMD1/CIR/P/2020/79 dated May 12, 2020, SEBI/HO/CFD/CMD2/CIR/P/2021/11 dated January 15, 2021 SEBI/HO/CFD/CMD2/CIR/P/2022/62 dated May 13, 2022 and SEBI/HO/CFD/PoD-2/P/CIR/2023/4 dated January 5, 2023 and SEBI Circular No. SEB/HO/CFD/CFD-PoD-2/P/CIR/2023/167 dated October07, 2023 ("SEBI Circulars") issued by the Securities and Exchange Board of India ("SEBI") (collectively referred to as "the Circulars"), without physical presence of the members at common venue.

The Notice of the AGM includes the process and manner of attending the AGM through VC and e-voting and other documents were e-mailed to all the Members whose e-mail addresses are registered with the Company or Depository participants on July 12 2024 in accordance with aforesaid Circulars. The requirements of sending physical copy of the Notice of the AGM to the Members have been dispensed. The Copy of Notice of AGM is also available on the Company's website at www.bondada.net website of Stock Exchange i.e. BSE Limited at www.bseindia.com and on KFir Technologies Limited website at www.evoting.kfintech.com.

The dispatch of the Notice of AGM along with other annexures is completed on July 19

Pursuant to the provisions of Section 101, 108 of the Companies Act, 2013 ("the Act" read with Rule 20 of the Companies (Management and Administration) Rules, 2014 as amended, the Secretarial Standard on General Meetings issued by the Institute of Company Secretaries of India and Regulation 44 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015 ("SEBI Listing Regulations"), as amended and the Circulars issued from time to time, the Company is pleased to provide to the Members the facility to exercise their right to vote prior to AGM and during AGM by electronic means and the business may be transacted through remote e-voting services provided by KFin Technologies Limited. The remote e-voting will commence on Friday, August 9, 2024;at 9:00 am and will end Sunday, August 11 2024, at 5:00 pm. The Members holding shares on Thursday, August 8, 2024 (cut-off date) will be entitled to exercise their voting rights through remote e-voting. The remote e-voting will not be allowed beyond its end time. The Members exercising to vote through remote e-voting can attend the AGM but will not be allowed to vote again during the AGM. Only the Members who have not cast their votes through remote evoting may cast their votes during the AGM by attending the AGM through VC. Any person, who acquires shares of the Company and become member of the Company after dispatch of the notice and holding shares as of the cut-off date i.e. Thursday August8, 2024 may obtain the login ID and password by sending a request at

Members holding shares in dematerialized mode are requested to register / update their KYC details including email address with the relevant Depository Participants Members holding shares in physical form are requested to register / update their KYC details including email address by submitting duly filled and signed form ISR-1 to Company's RTA at KFin Technologies Limited at Selenium Tower - B, Plot 31 & 32 Gachibowli, Financial District, Nanakramguda, Serilingampally, Hyderabad Telangana, 500032, Phone: 040-6716 2222, e-mail id: einward.ris@kfintech.com along with the required documents. Members are requested to quote their-DP ID & Client ID in case of shares are held in dematerialized mode and Folio No. in case shares are held in physical mode, in all correspondences with the RTA or the Company.

The documents pertaining to the Items of business to be transacted in the AGM will be available for electronic inspection without any fees by the members at least 10 days before the date of the meeting. Members seeking to inspect such documents can send an email to cs@bondada.net

The Board of directors have appointed M/s. Vivek Surana & Associates, Practicing Company Secretary, (ICSI membership number: A24531, certificate of practice number: 12901, as the Scrutinizer to scrutinize the voting processes in a fair and transparent manner.

As the AGM is being conducted through VC/OAVM, for the smooth conduct of proceedings of the AGM, members who would like to express their view/ ask question during the meeting may register themselves as speaker shareholders and may send their request mentioning name, mobile number, folio number, email id a cs@bondada.net. Shareholders who have registered themselves as speaker shareholders will only be allowed to express their views/ask questions during the

Any person, who acquires shares of the Company and becomes a member of the

Company after dispatch of the notice and holding shares as of the cut-off date i.e.

Thursday, August8, 2024, may obtain the login ID and password by sending a request at einward.ris@kfintech.com or RTA (KFin Technologies Limited) a einward.ris@kfintech.com. However, if he / she is already registered with KFin Technologies Limited for remote e-Voting then he/she can use his/her existing User ID and password for casting the vote. In case of any queries, you may refer the Frequently Asked Questions (FAQs) for Shareholders and e-voting user manual for Shareholders available at the download

section of evoting@kfintech.com or call on 18003094001or send a request a einward.ris@klintech.com The members will be able to attain the AGM via VC/OAVM/ view the live webcast of AGM via emeetings.kfintech.com by using their Evoting login credentials. The details procedure to attain AGM via VC/OAVM, manner of casting voting via E-voting and E-

voting during AGM is explained in the notes of the notice of AGM.

For, Bondada Engineering Limited Sonia Bidlan

(Company Secretary & Compliance Officer)

#### FORM A PUBLIC ANNOUNCEMENT

(Under Regulation 6 of the Insolvency and Bankruptcy Board of India (Insolvency Resolution Process for Corporate Persons) Regulations, 2016) FOR THE ATTENTION OF THE CREDITORS OF SEVENN PROTECTIVE FABRICS PRIVATE LIMITED

-					
Ш.	RELEVANT PARTICULARS				
1.	Name of corporate debtor	SEVENN PROTECTIVE FABRICS PRIVATE LIMITE (CIN U25200GJ2011PTC863495)			
2	Date of incorporation of corporate debtor	04/01/2011			
3.	Authority under which corporate debtor is incorporated / registered	RDC Ahmedabad			
4.	Corporate Identity No. of corporate debtor	U25200GJ2011PTC063495			
5.	Address of the registered office and principal office (if any) of corporate debtor	20B, Tin Murti Bunglows, Near Devansh Bunglow Surdhara Circle, Thaltej, Ahrnedabad, Gujarat, India, 380054			
6.	Insolvency commencement date in respect of corporate debtor	11.07.2024 (order received on 18.07.2024 by the IRP)			
7.	Estimated date of closure of insolvency	07.01.2025			

Name and registration number of the Rajendra Sanghi insolvency professional acting as interim (IBBI/IPA-001/IP-P-01973/2019-2020/13011) Address and e-mail of the interim B/2D Slddh chhakra appatment ,Near Sargam

resolution professional, as registered with shopping center Parle point, Surat, Gujarat , 395007 rajendra.sanghi@yahoo.co.in 10. Address and e-mail to be used for 64, First Floor, Okhla Estate Marg, behind Modi correspondence with the interim resolution, Mills, Okhla Phase III. Okhla Industrial Estate, New

professional sevennprotective.ibc@gmail.com 1. Last date for submission of claims 01.08.2024

12. Classes of creditors, if any, under clause NA (b) of sub-section (6A) of section 21, ascertained by the interim resolution professional

Representative of creditors in a class (Three names for each class) 14. (a) Relevant Forms and (b)Details of authorized representatives are

13. Names of Insolvency Professionals NA

identified to act as Authorised

resolution process

Notice is hereby given that the National Company Law Tribunal has ordered the commencement of a corporate insolvency resolution process of the Sevenn Protective Fabrics Private Limited on 11.07.2024 (order received on 18.07.2024 by the IRP).

The creditors of Sevenn Protective Fabrics Private Limited, are hereby called upon to submit their

claims with proof on or before 01.08.2024 to the Interim Resolution Professional at the address mentioned against entry No. 10. The financial creditors shall submit their claims with proof by electronic means only. All other creditors may submit the claims with proof in person, by post or by electronic means.

Submission of false or misleading proofs of claim shall attract penalties. Rajendra Sanghi (IBBI/IPA-001/IP-P-01973/2019-2020/13011)

Interim Resolution Professional In the matter of Sevenn Protective Fabrics Private Limited Date: 20-07-2024 Place: Ahmedabad, Gujarat AFA Valid Up to - 30.06.2025

J.L. Morison (India) Limited

CIN: U51109WB1934PLC088167

Regd. Office: 'Rasoi Court', 20, Sir R. N. Mukherjee Road,

Kolkata-700 001 Tel.: (033) 22480114/5

NOTICE TO THE EQUITY SHAREHOLDERS OF THE COMPANY

[for transfer of equity shares of the Company to Investor Education

and Protection Fund (IEPF) Authority]
NOTICE is hereby given that pursuant to the provisions of Sections 124 (5) &

(6) of the Companies Act, 2013 read with the Investor Education and Protection

Fund Authority (Accounting, Audit, Transfer and Refund) Rules, 2016 ('IEPF

Rules'), the final dividend declared by the Company for the financial year 2016-

17, which remained unclaimed/uncashed for a period of seven consecutive

years shall be credited to the Investor Education and Protection Fund. Further,

all the shares in respect of which dividend declared has remained

unclaimed/uncashed for a period of seven consecutive years or more from the

date of transfer to the Unpaid Dividend Account would also be transferred by

Pursuant to the said IEPF Rules, the necessary intimation has been sent to all

the concerned shareholders individually also, who have not claimed/encashed

dividend for the financial year 2016-17 and all subsequent seven vears

declared by the Company and whose shares are liable to be transferred to the

IEPF authority. The Company has uploaded the complete details of such

shareholders including their names, Folio Number or DP ID & Client ID and the

unpaid/unclaimed dividend amounts and the corresponding shares that are

due for transfer to DEMAT account of the IEPF authority on its website

https://www.jlmorison.com. Shareholders are requested to refer web-link

https://www.jlmorison.com/investors-relations/#IEPF to verify the details

of unclaimed /uncashed dividend and the shares that are liable to be

The concerned shareholders, holding shares in physical form and whose

shares are liable to be transferred to the IEPF Authority, may note that the

Company would be issuing new share certificate(s) in lieu of the original share

certificate(s) held by them for the purpose of transfer of shares to the IEPF

Authority as per the IEPF Rules and upon such issue, the Company shall

inform the depositories by way of corporate action to convert the share

certificates into DEMAT form and transfer in the DEMAT account of the IEPF

Authority. The original share certificate(s) which are registered in the name of

original shareholders shall stand cancelled automatically and be deemed non-

The concerned shareholders holding shares in the dematerialized form may

note that the Company shall inform the depositories by way of corporate action

Shareholders may note that both the unclaimed/uncashed dividend and the

shares transferred to the IEPF Authority including all the benefits accruing on

such shares, if any, can be claimed back by them from IEPF Authority by

making an application in the prescribed e-Form IEPF-5 online and sending the

physical copy of the requisite documents enumerated in the e-Form IEPF-5, to

the Nodal Officer of the Company at its Registered Office or to CB

Management Services Private Limited, Registrar and Transfer Agent (RTA) of

the Company for verification of their claim after following the procedure as

In case the Company does not receive any valid claim from the concerned

shareholders on or before 30th October, 2024, the Company shall with a view to

comply with the requirements of the said IEPF Rules, proceed to transfer the

liable dividend amount and Equity shares into the DEMAT Account of the IEPF

Authority as per the procedure stipulated in the IEPF Rules. Please note that no

claim shall lie against the Company in respect of unclaimed/uncashed dividend

amount and shares so transferred into the DEMAT account of the IEPF

In case you need any further information/clarification, please write to, or

contact our Registrar and Transfer Agent at CB Management Services Private

Limited, Unit - J. L. Morison (India) Limited, P-22, Bondel Road, Kolkata-700

For J. L. Morison (India) Limited

Sohan Sarda

DIN: 00129782

Place: Mumbai

Date: 19" July 2024

**Executive Director** 

for transfer of shares in favour of DEMAT account of the IEPF Authority.

the Company in DEMAT account of the IEPF Authority.

transferred to the IEPF Authority.

prescribed under the IEPF Rules.

Authority pursuant to the said IEPF Rules.

019, Tel. No.: (033) 40116700, e-mail: rta@cbmsl.com.





### WALCHANDNAGAR INDUSTRIES LIMITED Regd. Office: 3, Walchand Terraces, Tardeo Road, Mumbai - 400034. CIN: L74999MH1908PLC000291. Tel.: (022) 23612195 / 96 / 97 E-mail: investors@walchand.com, Website: www.walchand.com

## NOTICE OF 115TH ANNUAL GENERAL MEETING

NOTICE is hereby given that the 115th Annual General Meeting (AGM) of Walchandnagar Industries Limited will be held on Wednesday, August 14, 2024 at 04:30 pm (IST), through Video Conferencing ("VC") / Other Audio Visual Means ("OAVM") to transact the business as set out in the Notice of the AGM which is being circulated for convening the AGM. The Ministry of Corporate Affairs ("MCA") has vide its General Circular Nos. 14/2020 dated April 08.

2020, Circular No.17/2020 dated April 13, 2020, and all subsequent circulars issued in this regard, the latest being 09/2023 dated September 25, 2023, permitted the holding of AGM through VC or OAVM without the physical presence of the Members at a common venue. In compliance with these circulars and the relevant provisions of the Companies Act, 2013, the AGM of the Company will be held The Notice of the AGM along with the Annual Report for FY 23-24 is being sent only through electronic

mode to those Members whose email addresses are registered with the Company/ Depositories in accordance with the aforesaid MCA Circulars and SEBI Circulars dated May 12, 2020, January 15, 2021, May 13, 2022, January 05, 2023 and October 07, 2023. The requirements of sending Physical copy of the Notice of the 115th AGM and Annual Report to the

Members have been dispensed with vide MCA Circulars and SEBI Circulars. The Annual Report for

FY 23-24 will also be available on the Company's website www.walchand.com, website of the Stock

Exchanges where the equity shares of the Company are listed i.e. BSE Limited www.bseindia.com and NSE www.nseindia.com and on the website of NSDL https://www.evoling.nsdl.com. Members can attend and participate in the AGM through VC/ OAVM facility only and their attendance shall be counted for the purpose of reckoning the quorum under section 103 of the Companies Act, 2013. The instructions for joining the AGM are provided in the Notice of the AGM. Remote e-voting facility is provided to the members to cast their votes on any of the resolutions set out in the notice of the AGM. Additionally, the Company is providing facility of e-voting during the AGM.

The Members who have cast their votes by remote e-voting prior to the AGM may also attend / participate in the AGM but shall not be entitled to cast their vote again. Those members who shall be present in the AGM through VC / OAVM facility and have not cast their vote through remote e-voting and are otherwise not barred from doing so, shall be eligible to vote during the AGM. Only those members whose email addresses are registered in the Register of Members maintained by the Depositories as on the cut-off date i.e. Wednesday, August 07, 2024, shall be entitled to avail

the facility of remote e-voting as well as voting during the AGM. If your email address is already registered with the Company / Depositories, login details for e-voting will be sent on your registered email address.

The details of remote e-voting are given below:

 The remote e-voting will commence on Sunday, August 11, 2024 (9.00 am) and end on Tuesday, August 13, 2024 (5.00 pm). The e-voting module shall be disabled for voting thereafter.

i) The voting rights of the Members shall be in proportion to their share in the paid-up share capital of the Company as of the record date i.e. Wednesday, August 07, 2024. Once a vote is cast by the Member, he/ she shall not be allowed to change it subsequently.

ii) Any person who acquires equity shares of the Company and becomes a Member after July 12, 2024 i.e. cut-off date for dispatch of the Notice and eventually holds shares as on the cut-off date i.e. Wednesday, August 07, 2024, he/ she may obtain the login details by writing to the Registrar and Share Transfer Agent at evoting investors@linkintime.co.in or to NSDL at helpdesk.evating@nsdl.co.in.

n case of any queries pertaining to e-voting, members may refer to the Frequently Asked Questions (FAQs) and e-voting User's Manual available under help section at www.evoting.nsdi.com or email at helpdesk. evoting@nsdl.co.in. (Toll Free No. Tel. 1800 222 990)

For Walchandnagar Industries Ltd.,

Place: Mumbai Date: July 19, 2024

G. S. Agrawal Whole Time Director & Company Secretary



# SUNSHIELD SUNSHIELD CHEMICALS LIMITED

behind RBK International School, Chembur-West, Mumbai - 400 043 Phone No.: 25550126 E Mail: investorservices@sunshieldchemicals.com Website: www.sunshieldchemicals.com NOTICE OF 37™ ANNUAL GENERAL MEETING AND E-VOTING INFORMATION NOTICE is hereby given in continuation of pubic advertisement dated 14" July 2024 that

the 37th Annual General Meeting ("AGM") of SUNSHIELD CHEMICALS LIMITED ("the Company") will be held on Wednesday, 14" August 2024 at 11:00 a.m. (IST) through Video Conference ("VC") or Other Audio Visual Means ("OAVM") without the physical presence of Members to transact the business as set forth in the Notice of the AGM. The Notice of the AGM together with the Annual Report for year ended 31" March, 2024 and process, manner and instructions for e-voting has been sent to Members by e-mail on

Friday, 19th July, 2024 to those shareholders whose e-mail IDs were registered with the Company/Depositories on Friday, 12" July, 2024. The same is also available on the Company's website at www.sunshieldchemicals.com on the Stock Exchange's website at www.bseindia.com and on the website of National Securities Depository Limited (NSDL) at Remote E-Voting and E-Voting at the AGM In compliance with provisions of section 108 of the Companies Act, 2013, Rule 20 of the

Companies (Management and Administration) Rules, 2014 as amended from time to time

and Regulation 44 of SEBI LODR and the Secretarial Standards on General Meetings (SSissued by the Institute of Company Secretaries of India, as amended from time to time, the Company is providing to its Members the facility of remote e-Voting before and during the AGM in respect of the business to be transacted at the AGM and for this purpose, the Company has appointed NSDL for facilitating voting through electronic means. The detailed instructions for remote e-Voting are given in the Notice of the 37" AGM. Members are requested to note the following: a. The remote e-Voting facility would be available during the following e-voting period:

Commencement of From 9.00 a.m. IST of Sunday, 11" August, 2024 (09.00 am. IST) emote e-voting

End of remote e-voting Upto 5.00 pm. IST of Tuesday, 13" August, 2024 (05:00 p.m. IST) A person whose name is recorded in the Register of Members/Beneficial Owners maintained by the Depositories as on the cut-off date for e-voting i.e. Wednesday, 7 August, 2024 only shall be entitled to avail the facility of remote e-voting as well as e-

voting at the AGM. The voting rights of the Members shall be in the proportion to the equity shares held by them in the paid-up equity share capital of the Company as on cutoff date i.e; Wednesday, 7" August, 2024.

The members can opt for only one mode of remote e-voting i.e. either prior to the AGM or during the AGM. However, the members who have cast their vote by remote e-voting may also attend/participate in the AGM through VC/OAVM but shall not be entitled to cast their vote again in the meeting.

. The Members can attend the AGM through VC/OAVM provided by NSDL and can also e-vote on all the resolutions as set forth in the Notice during the AGM, only if they have not cast their vote earlier by remote e-voting. The detailed procedure for obtaining Password and the instructions for e-voting are also

provided in the Notice of the meeting. A person who is not a Member as on cut-off date i.e; Wednesday, 7th August, 2024 should treat the Notice of the AGM for information purpose only.

Mr. Prasen Naithani of P. Naithani & Associates, Practicing Company Secretary (Membership No: 3830) has been appointed as the Scrutinizer to scrutinize the remote e-voting process before/during the AGM in a fair and transparent manner.

In case of any queries relating to e-voting, you may refer the Frequently Asked Questions (FAQs') and e-voting user manual for Shareholders available at the download section of www.evoting.nsdl.com or call on toll free no.: 022 - 4886 7000 or send a request at evoting@nsdl.co.in.

For Sunshield Chemicals Limited Amit Kumashi

Company Secretary

NVENTURE

Place: Mumbai

Date: 19.07.2024

Registered Office: 201,2nd Floor, Viraj Towers, W.E. Highway, Andheri- East, Mumbai- 400069 **Tel:** +091-022-71148500, 40751515 | **Email ID**: info@inventuregrowth.com

CIN: L65990MH1995PLC089838

## **EXTRACT OF STANDALONE AND CONSOLIDATED UNAUDITED** FINANCIAL RESULTS FOR THE QUARTER ENDED 30TH JUNE, 2024

( Amount ₹ in lakhs) **STANDALONE CONSOLIDATED Quarter Ended** Year Ended **Quarter Ended** Year Ended **Particulars** 30.06.2024 31.03.2024 30.06.2023 31.03.2024 30.06.2024 31.03.2024 30.06.2023 31.03.2024 (Audited) (Unaudited) (Audited) (Audited) (Unaudited) (Audited) (Unaudited) 1,507 759 Total Income 1,320 4,817 1,869 2,267 1,057 6,251 Net Profit/(Loss) for the period (before Tax, Exceptional and/or Extraordinary items) 459 376 113 1,351 931 1,124 146 2,148 Net Profit/(Loss) for the period before Tax (after Exceptional and/or Extraordinary items) 434 230 113 1,002 906 978 146 1,799 Net Profit/(Loss) for the period after Tax (after Exceptional and/or Extraordinary items) 290 97 73 606 643 700 73 1,201 Total Comprehensive Income for the period [Comprising Profit/(Loss) for the period (after tax) and Other Comprehensive Income (after tax)] 280 103 60 599 691 713 75 1,287 Equity Share Capital 8400 8400 8400 8400 8400 8400 8400 8400 Reserves (excluding Revaluation Reserve) as shown in the Audited Balance Sheet of the 22,163 17,442 Earnings Per Share (of ₹1/- each) - Not Annualised 1. Basic 0.03 0.01 0.01 0.07 0.08 0.08 0.01 0.14 2. Diluted 0.03 0.01 0.01 0.07 0.08 0.08 0.01 0.14

Note:

Place: Hyderabad

Date: July 20, 2024

The above is an extract of the detailed format of guarterly results filed with Stock Exchanges under Regulation 33 of the SEBI (Listing and Other Disclosure Requirement) Regulation, 2015. The full format of the Quarterly Financial Results are available on the websites of the Stock Exchanges (www.bseindia.com, www.nseindia.com) and the Company's Website, www.inventuregrowth.com. On Behalf of the Board of Directors

> Kanji B. Rita DIN - 00727470 Chairman & Managing Director

Inventure Growth & Securities Limited

**ELECTRONICS LIMITED** CIN: L03210TZ1985PLC001535 Regd. Office: Samichettipalayam, Ph: 0422-4233600/4233614

Fax: 0422-2692170.

Email: investor\_relations@salzergroup.com &

Website: www.salzergroup.com

NOTICE TO THE SHAREHOLDERS (Transfer of shares to Investor Education and Protection Fund) Notice is hereby given to the Shareholders of

Salzer Electronics Limited (herein after referred to "the Company") that pursuant to Section 124(6) of the Companies Act 2013 read with **Investor Education and Protection Fund Authority** (Accounting, Audit, Transfer and Refund) Rules, 2016 and Amendment Rules, 2019 ("Rules") all Shares in respect of which dividend has not been claimed for seven consecutive years from 2016-2017 will be transferred by the Company in the name of the Investor Education and Protection Fund ("IEPF"). The Company has couriered individual notice to the shareholders concerned advising them to

claim the Dividend expeditiously. The details of the shareholders and the shares due for transfer are available on the Company's web site www.salzergroup.net. In case no valid claim is received for the Dividend on or before October 15, 2024, the equity shares in respect of such Unclaimed Dividend will be transferred to IEPF in accordance with Rules on

or before November 14, 2024. In the event of the shareholders not claiming the Dividend and the related shares are transferred to IEPF, the Shareholders are still entitled to claim the shares from IEPF by making an on-line application in Form IEPF-5 to the IEPF Authority. The procedure and the Form are available at

By order of the Board of Directors (Sd/-) CS K.M. Murugesan Company Secretary & Compliance Officer ACS: 25953

Date : July 19, 2023 Place: Coimbatore

www.iepf.gov.in.

Place : Mumbai

Date: 18.07.2024

financialexp.epapr.in



CIN: L17120DN1994PLC000387 **રજી. ઓફીસ** : ૯૯/૨/૧ અને ૯, મધુબન ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ, મધુબન ડેમ રોડ, રાખોલી ગામ, ચું.ટી. દાદરા અને નગર હતેલી, સિલવાસા-૩૯૬૨૩૦ ફો**ન** : +૯૧ (૦૨૬૦) ૩૨૦ ૦૯૪૮, ફેક્સ : +૯૧ ૨૨ ૪૯.૭૯ ૦૩૦૪, **ઇમેઇલ** : info@emmbi.com, **વેબસાઇટ** : www.emmbi.com

#### કંપનીની અસાદ્યારણ સભાની નોટીસ અને રીમોટ ઈ-વોટીંગ માહિતી

આથી નોટીસ આપવામાં આવે છે કે એમ્બી ઈન્ડ્સ્ટ્રીઝ લિમિટેડના સભ્યોની અસાધારણ સામાન્ય સભા (ઈજીએમ) વીડિયો કોન્ફરન્સીંગ (વીસી)/ અન્ય ઓડિયો માધ્યમો (ઓએવીએમ) સવલત મારફતે મંગળવાર, ૧૩ ઓગસ્ટ ,૨૦૨૪ ના રોજ સવારે ૧૧.૩૦ કલાકે (ભારતીય સમયે) યોજાશે. કંપની કાયદા, ૨૦૧૩ (એક્ટ) ની તમામ લાગુ જોગવાઈઓ અને તે હેઠળ બનેલ નિયમો અને સિક્યોરીટીઝ અને એક્સરોન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા (સેબી) (લિસ્ટીંગ ઓબ્લીગેશન્સ અને ડિસક્લોઝર રીક્વાયરમેન્ટ્સ) નિયમનો, ૨૦૧૪ સાથે વંચાતા કોર્પોરેટ અફેર્સ મંત્રાલય દ્વારા જારી ડિસક્લોઝર રીક્વાયરમેન્ટ્સ) નિયમનો, ૨૦૧૪ સાથે વંચાતા કોર્પોરેટ અફેર્સ મંત્રાલય દ્વારા જારી ડિસક્લોઝર રીક્વાયરમેન્ટ્સ) નિયમનો, ૨૦૧૪ સાથે વંચાતા કોર્પોરેટ અફેર્સ મંત્રાલય દ્વારા જારી ડિસક્લોઝર રીક્વાયરમેન્ટ્સ, ૧૧/૨૦૨૨ તારીખ ૨૮ ડિસેમ્બર, ૨૦૨૨ અને જનવસ સરક્યુલર નં. ૧૧/૨૦૨૩ (એક સાથે એમસીએ પરિપળો તરીકે દર્શાવેલ છે) અને સેબી સરક્યુલર નં. SEBI/HO/CFD/PoD-2/P/CIR/2023/167 તારીખ ૭ ઓક્ટોબર, ૨૦૨૩ (એક સાથે સેબી પરિપળો તરીકે દર્શાવેલ છે) ના અનુપાલન અંતર્ગત એકજ સ્થળે સભ્યોની પ્રત્યક્ષ લાજરી વગર વિસી/ઓએબીએમ મારફત એજીમ યોજવાની પરવાનગી આપેલ છે. સભ્યો વીસી/ઓએબીએફ દ્વારા ઈજીએમમાં હાજર રહી શકશે અથવા https://www.evoting.nsdl.com ઉપર લાઈવ વેબકાસ્ટ પણ જોઈ શકશે. વીસી/ઓએબીએમ સવલત મારફત ભાગ લેનાર સભ્યોને એક્ટની કલમ ૧૦૩ હેઠળ કોરમની ગણતરી માટે દયાનમાં લેવામાં આવશે.

ઉપરોક્ત એમસીએ પરિપગો અને સેબી પરિપગો અનુસાર ઇજીએમની નોટીસ જેમના ઇમેઇલ એડ્રેસીઝ કંપની/રજીસ્ટ્રાર અને શેર ટ્રાન્સફર એજન્ટ્સ/ડિપોઝીટરી પાર્ટીશીપન્ટો પાસે નોંધાચેલા છ તેવા શેરહોલ્ડરોને ફક્ત ઇલેક્ટ્રોનિંગ પદ્ધતિ મારફત મોકલાવાચેલ છે. ઇજીએમની નોટીસ કંપનીની વેબસાઇટ www.emmbi.com બીએસઇ લીમીટેડ અને નેશનલ સ્ટોક એક્સચેન્જઓફ ઇન્ડિયા લીમીટેડની વેબસાઇટ એટલે કે અનુક્રમે www.bseindia.com અને www.nseindia.com ઉપર અને નેશનલ સિક્યોરીટીઝ ડિપોઝીટરી લીમીટેડ (એનએસડીએલ)ની વેબસીટ https://www.evoting.nsdi.com ઉપર ઉપલબ્ધ રહેશે.

આ ઉપરાંત જાણ કરવાની કે કંનપીએ ઈજીએમની નોટીસની ૨વાનગી ૧૯ જુલાઈ, ૨૦૨૪ ના રોજ પૂર્ણ કરી છે.

એક્ટની કલમ ૧૦૮ અને કંપની (વ્યવસ્થાપન અને પ્રશાસન) નિયમો, ૨૦૧૪ સુધારેલના નિયમ ૨૦ અને સેબી (લિસ્ટીંગ ઓબ્લિગેશન્સ એન્ડ ડિસ્ક્લોઝર્સ રિક્લાયરમેન્ટ્સ) નિયમનો, ૨૦૧૫ ના નિયમન ૪૪ મુજબ, કટ-ઓફ તારીખ ના રોજ , એટલે કે મંગળતાર, દૃ ઓગસ્ટ, ૨૦૨૪ ના રોજ ફીઝીકલ અથવા ડિમટીરીયલાઇઝ્ડ સ્વરૂપે શેરહોલ્ડીંગ ધરાવતા સભ્યો, ઇઝુએમની નોટીસમાં જણાવેલ કામકાજો ઉપર https://www.evoting.nsdl.com યુઆરએલ લોન્ય કરીને ઇ-વોટીંગ પ્લેટફોર્મ મારફતે ઇલેક્ટ્રોનિકલી તેમનો મત આપી શકશે, કારણકે કંપનીએ એનએસડીએલની ઇ-વોટીંગ સેવાઓ લીધી છે. ઇ-વોટીંગ માટેની વિગતવાર પ્રક્રિયા/સૂચનાઓ કંપનીની ઇઝુએમની નોટીસમાં આપેલ છે.

આ સબંધમાં, સભ્યોને વધુમાં જાણ કરવાની કે:

- (એ) રિમોટ ઇ-વોર્ટીંગ શુક્રવાર, ૯ ઓગસ્ટ, ૨૦૨૪ ના રોજ સવારે ૯:૦૦ કલાકે ભારતીય સમયે શરૂ થશે અને સોમવાર, ૧૨ ઓગસ્ટ, ૨૦૨૪ ના રોજ સાંજે ૫:૦૦ કલાકે ભારતીય સમયે પૂર્ણ થશે.
- (બી) રિમોટ ઇ-વોર્ટીંગ અને ઈજીએમમાં વોર્ટીંગ માટેની કટ ઓફ તારીખ મંગળવાર, દ્ર ઓગસ્ટ ૨૦૨૪ છે.
- (સી) ઈજીએમની નોટીસની રવાનગી પછી કંપનીના શેરો પ્રાપ્ત કરનાર અને કંપનીની સભ્ય બનનાર અને કટ-ઓફ તારીખ એટલે કે મંગળવાર દ્ર ઓગસ્ટ, ૨૦૨૪ ના રોજ શેરહોલ્ડીંગ ધરાવતી કોઈપણ વ્યક્તિ – ઉપર ઈમેઈલ અરજી મોકલીને લોગીન આઈડી અને પાસવર્ડ મેળવી શકે છે. આમ છતાં જો તે/તેણી રીમોટ ઈ-વોટીંગ માટે પહેલેથી એનએસડીએલમાં રજીસ્ટર્ડ છે તો તેઓ તેમના મત આપવા માટે તે/તેણીના ચાલુ યુઝર આઈડી અને પાસવર્ડનો પણ ઉપયોગ કરી શકે છે.
- (ડી) વીસી ઓએવીએમ મારફત સભામાં હાજર રહેનાર સભ્યો અને જેમણે રીમોટ ઇ-વોટીંગ મારફત ઠરાવો પર તેમના મત આપેલ નથી અને તેમ કરવા પ્રતિબંધિત નથી તેઓ ઈજીએમ દરમિયાન ઇ-વોટીંગ પદ્ધતિ મારફત મત આપવા હકદાર ગણાશે. વીસી/ઓએવીએમ મારફત ઈજીએમમાં હાજર રહેવાની સુચનાઓ ઈજીએમની નોટીસમાં આપેલ છે. જે સભ્યોએ ઈજીએમ પહેલા રીમોટ ઇ-વોટીંગ થી તેમના મત આપ્યા છે તેઓ વીસી/ઓએવીએમ સવલત મારફત ઈજીએમમાં પણ હાજર રહી શકે છે/ ભાગલઈ શકે છે, પરંતુ ઈજીએમમાં ફરીથી તેમના મતો આપવા હકદાર ગણાશે નહી.
- (એફ) જેવ્યક્તિનું નામ કટ– ઓફ તારીખના રોજરજીસ્ટર ઓફ મેમ્બર્સ અથવા ડિપોઝીટરીઓ દ્વારા સંચાલિત લાભાર્થી માલિકોનમા રજીસ્ટરમાં નોંધાચેલ છે ફક્ત તે જરીમોટ ઇ–વોટીંગ અને ઈજીએમ દરમિયાન ઇ–વોટીંગની સવલત મેળવવા માટે હકદાર ગણાશે.
- (જી) ઇ-વોટીંગને સંબંધિત કોઈપણ પૂછપરછના કિસ્સામાં, સભ્યો https://www.evoting.nsdl.com ખાતે ઉપલબ્ધ ફિક્વન્ટલી આસ્ક્ક ક્વેશ્ન્સ (એફ્એક્ચુઝ) અને ઇ-વોટીંગ મેન્ચુઅલનો જોઈ શકે છે અથવા શ્રીમતી પલવી મ્હાયે, સિનિયર મેનેજર, નેશનલ સિક્ચોરીટેઝ ડિપોઝીટીરી લીમીટેડ, ડેટ વર્લ્ડ, એ વિંગ, ચોથો અને પાંચમો માળ, કમલા મિલ્સ કંપાઉન્ડ, લોઅર પારેલ, મુંબઇ, મહારાષ્ટ્ર-૪૦૦ ૦૧૩ નો સંપર્ક કરવો અથવા ૦૨૨ ૪૮૮૬,૦૦૦ને કોલ કરી શકો છો અથવા evoting@nsdl.com ને ઇમેઈલ અરજી મોકલી શકો છો.

કંપનીના બોર્ડ ઓફ ડાચરેક્ટર્સે ચોગ્ય અને પારદર્શક પદ્ધતિમાં રીમોટ ઈ-વોટીંગ અને ઈજીએમમાં ઈ-વોટીંગ મારફત વોટીંગને સ્ફ્રુટીનાઈઝ કરવા માટે સ્ફ્રુટીનાઈઝર તરીકે શ્રી સંજ્ય ધોળકિયા, વ્યવસાયિક કંપની સેક્રેટરી (પીસીએસ નં. ૧૭૯૮), મેસર્સ સંજ્ય ધોળકિયા એન્ડ એસોસિયેટ્સ કંપની સેક્રેટરીઝની નિમણુંક કરી છે.

એમ્બી ઇન્ડ્સ્ટ્રીઝ લિમિટેડ માટે, સહી/– સ્થળ : મુંબઇ રાજેશ સોલંકી તારીખ : ૧૯મી જુલાઇ, ૨૦૨૪ કંપની સેક્રેટરી

## કળજા નોટીસ

આથી, જના સ્મોલ ફાયનાન્સ બેંક લીમીટેક (અગાઉ જનલકમી ફાયનાન્સિયલ સર્વિસીઝ લીમીટેડ તરીકે જાણીતી) ના અધિકૃત અધિકારીએ, સિક્ચોરીટાઇઝેશન અને રીકન્સ્ટર્ફ્શન ઓફ ફાયનાન્સિયલ એસેટ્સ અને એન્ફોર્સમેન્ટ ઓફ સિક્ચોરીટી ઇન્ટરેસ્ટર એક્ટ, ૨૦૦૨ હેઠળ અને સિક્ચોરીટી ઇન્ટરેસ્ટ (એન્ફોર્સમેન્ટ) નિયમો, ૨૦૦૨ ના નિયમ 3 સાથે વંચાતી કલમ ૧૩(૧૨) હેઠળ મળતી સત્તાનો ઉપયોગ કરીને દેવાદાર(રો)/ સહ–દેવાદાર(રો) ને માંગણાં નોટીસ જારી કરી દેવાદારોને તેમના લાગતા વળગતા નામ સામે જણાવેલ રકમ જણાવેલ નોટીસમાં જણાવ્યા મુજબ લાગુ દરોએ તેના પરના વ્યાજ તેમજ ચુકવણી અને / અથવા છુટકારાની તારીખ સુધી લદાયેલ ચડત વ્યાજ, લાગુ આકરિમક ખર્ચ, પડતર ખર્ચ, ચાર્જ વગેરે સહીત જણાવેલ નોટીસો મળયાથી ૬૦ દિવસની અંદર ચુકવવા જણાવ્યું હતું.

ક્રમ ન.	લોન નંબર	દેવાદાર/ સહ–દેવાદાર/ જામીનદાર/ગીરવેદાર	૧૩(૨) નોટીસની તારીખ / બાકી રકમ (રૂા. માં) ના રોજ	કબજાનો પ્રકાર અને તારીખ / સમય
9	34056830000364 34056830000364	૧. વિંદેશ, ૨. ગરિમા	૨૩/૦૨/૨૦૨૪ ફા. ૧૦,૫૧,૬૯૨.૦૦/– (રૂપિયા દસ લાખ એકાવન હજાર છસ્સો બાણું પુરા) ૨૩/૦૨/૨૦૨૪ મુજબ	૧૯/૦૭/૨૦૨૪ ૦૯:૩૦ એએમ અને ભૌતિક કબજો

કલેટ નં. ૨૦૬, બીજો માળ, ક્ષેત્રફળ ૪૩૨ ચો.કુંટ એટલે કે ૪૦.૧૫ ચો.મી., બિલ્ટ અપ એરિયા, અને ૭૨૦.૦૦ ચો.કુટ એટલે કે દ્દદ.૯૧ ચો.મી., સુપર બિલ્ટ અપ એરિયા તેમજ ૮.૨૭ ચો.મી., રોડ, પાર્કિંગ અને સીઓપીની જમીનમાં ન વહેંચાયેલ હિસ્સો ધરાવતી હરિકુંજ એવન્થુ, બિલ્ડીંગ નં. બી, સાંઇ વાટીકા રો હાઉસ વિભાગ–૨ ની, રેવન્થુ સર્વે નં.૨૦૧/૧ અને ૧૧૦/૧, ૧૧૦/૨ અને ૧૧૧, બ્લોક નં. ૨૭૦ અને ૨૭૧, ૨૭૨/એ, કુલ ક્ષેત્રફળ હેક્ટર અરે ૦–૭૭–૨૯ ચો.મી. પૈકી, પ્લોટ નં. ઇ/૧, (મંજુદ કરેલ પ્લાન મજુબ પ્લોટ નં. પર અને ૫૪), ક્ષેત્રફળ ૪૬૫ ચો.મી. પૈકી, પ્લોટ નં. ઇ/૧, (મંજુદ કરેલ પ્લાન મજુબ પ્લોટ નં. પર અને ૫૪), ક્ષેત્રફળ ૪૬૫ ચો.મી. તેમજ ૧૬૩.૦૦ ચો.મી., રોડ અને સીઓપીની જમીનમાં ન વહેંચાયેલ હિસ્સો મોજે ગામ બાગુમારા, તાલુકો પલસાણા, જિલો સુરત ખાતેની વિદેશ અજ્કુમાર તિવારીની માલિકની સ્થાવર મિલકતના તમામ ભાગ અને હિસ્સા. ચતુ:સીમા : પુર્વ: ફ્લેટ નં. ૨૦૩, પશ્ચિમ: હરીવીલા બિલ્ડીંગ, ઉત્તર: ફ્લેટ નં. ૨૦૭, દક્ષિણ: ફ્લેટ નં. ૨૦૦

ર	<b>૪૫૨૫૯૪૨૦૦૦૪૦</b> ૨૬	૧. પિન્ટુ પાલ, ૨. પુજા પાલ	૧૨/૦૨/૨૦૨૪, રૂ૧. ૭,૭૧,૫૯૮.૩૦/– (રૂપિચા સાત લાખ ઇકોત્તેર હજાર પાંચસો અકાણું અને ત્રીસ પૈસા પુરા) ૦૬/૦૨/૨૦૨૪ મુજબ	૧૯/૦૭/૨૦૨૪ ૦૮:૦૦ એએમ અને ભૌતિક કબજો
---	------------------------	-------------------------------	--	---

કલેટ નં. ૨૦૫, બીજો માળ, ક્ષેત્રફળ દુગ્ય.૦૦ ચો. ફુટ અંદાજે દ્દર.૭૧ ચો.મી. સુપર બિલ્ટ અપ એરિયા અને ૪૦૭.૦૦ ચો. ફુટ અંદાજે ૩૭.૮૧ ચો.મી. બિલ્ટ અપ એરિયા તેમજ જમીનનો ન વહેંચાયેલ હિસ્સો, ''સમતા કોમ્પલેક્ષ પારેખ એસ્ટેટ", મુકામ-રેવન્થુ સર્વ નં. ૧૯૨–એ, ૧૯૩, ૧૯૦, ૧૯૬, ૧૯૭, ૧૯૨–એ, બ્લોક નં. ૧૨૨ પૈકી પ્લોટ નં. ૯૪ અને ૯૫ ક્ષેત્રફળ ૪૦૧.૪૮ ચો.મી., મોજે-તાંતીથેચા, તાલુકો-પલસાણા, જિલો–સુરત જેની માલિકી ૧. પુજા પિન્દુ પાલ અને ૨. પિન્દુ પાલની સ્થાવર મિલકતના તમામ ભાગ અને હિસ્સા. ચતુ:સીમા :પુર્વ: નેશનલ હાઇવે નં. ૮, પશ્ચિમ : બ્લોક નં. ૨૭, ઉત્તર : પ્લોટ નં. સી/૭, દક્ષિણ : બ્લોક નં. ૨૯ (કોહિનુર

	માલ ખુલા જમાન)			
3	34056850005348	૧. પાટિલ ઇશ્વરભાઇ, ૨. સુષ્મા ઇશ્વર પાટિલ	૧૨/૦૨/૨૦૨૪ રા. ૯,૭૯,૨૧૨.૦૨/– (રૂપિયા નવ લાખ ઓગણએંશી હજાર બસ્સો બાર અને બે પૈસા પુરા) ૦૬/૦૨/૨૦૨૪ મુજબ	૧૯/૦૭/૨૦૨ ૦૯:૦૦ એએમ અને ભૌતિક કબજો

કલેટ નં. ૧૦૮, પહેલો માળ, ક્ષેત્રફળ ૪૮૨.૦૦ ચો. કુટ અંદાજે ૪૪.૮૦ ચો.મી. બિલ્ટ અપ એરિયા અને ૮૦૩.૦૦ ચો. કુટ અંદાજે ૭૪.૬૬ ચો.મી. સુપર બિલ્ટ અપ એરિયા તેમજ ૯.૨૨ ચો.મી. ન વહેંચાચેલ જમીનની હિસ્સો, પહેલો માળ, બિલ્ડીંગ નં. બી, "હરિકુંજ એવન્ચુ, સાંઇ વાટિકા રો હાઉસ વિભાગ--" તરીકે જાણીતી, મુકામ-રેવન્ચુ સર્વે નં. ૨૦૧/૧, ૧૦૧/૧, ૧૦૧/૧, ૧૦૧, ૧૦૧ નં. ૨૦૦, ૨૭૧ અને ૨૦૨/એ, ક્ષેત્રફળ હેક્ટર આરે. ૦–૭૭-૨૯ ચો.મી., પૈકી પ્લીટ નં. ઇ/એ, (પાસિંગ પ્લાન મુજ નં. ૫૨, ૫૩ અને ૫૪) ક્ષેત્રફળ ૪૬૫.૦૦ ચો. ચાંડે અંદાજે ૩૮૮.૭૯ ચો.મી. અને ૧૬૩.૦૦ ચો.મી. ન વહેંચાચેલ જમીન, રોડ અને સીઓપીનો હિસ્સો, મોજે-ગામ-બાગુમારા, તાલુકો-પલસાણા, જિલો-સુરત જેની માલિકી ૧. સુષ્મા ઇશ્વર પાટિલ અને ૨. ઇશ્વરભાઇ સમક્રિશન પાટિલની સ્થાવર મિલકતના તમામ ભાગ અને હિસ્સા. ચતુ:સીમા: ઉત્તર:એ-બિલ્ડીંગ, દક્ષિણ: ફલેટ નં. ૧૦૭, પૂર્વ: ફલેટ નં. ૧૦૦ નો પેસેજ, પશ્ચિમ: દરીવીલા બિલ્ડીંગ

અહીં ઉપર જણાવેલ દેવાદારો / સહ–દેવાદારો / જામીનદારો / ગીરવેદારો બાકી રકમ ચુકવવામાં નિષ્ફળ ગયા હોવાથી ખાસ કરીને ઉપર જણાવેલ દેવાદારો અને જાહેર જનતાને નોટીસ આપવામાં આવે છે કે જના સ્મોલ ફાચનાન્સ બેંક લીમીટેડના અધિકૃત અધિકારીએ જણાવેલ નિયમોના આવે છે કે જના સ્મોલ ફાચનાન્સ બેંક લીમીટેડના અધિકૃત અધિકારીએ જણાવેલ નિયમોના નિયમ ૮ સાથે વંચાતી એક્ટની કલમ ૧૩(૪) હેઠળ તેમને પ્રાપ્ત સત્તાનો ઉપયોગ કરીને ઉપર જણાવેલ તારીખોએ અહી ઉપર જણાવેલ મિલકતો / સિક્ચોર્ડ એસેટોનો **સાંકેતિક કબજો** લઇલીધો છે. ખાસ કરીને અહી ઉપર જણાવેલ દેવાદારો / જામીનદારો / ગીરવેદારો અને જાહેર જનતાને આથી ઉપર જણાવેલ મિલકતો / સિક્ચોર્ડ એસેટો સાથે સોદો ન કરવા સાવદા કરવામાં આવે છે અને જણાવેલ મિલકતો / સિક્ચોર્ડ એસેટો સાથે કોઇપણ સોદો જના સ્મોલ ફાયનાન્સ બેંક લીમીટેડના ચાર્જને આધિન રહેશે.

સામાંડગા સાજન ભારાન રહેશ. સ્થળ : અમદાવાદ સહી/– અધિકૃત અધિકારી તારીખ : ૨૦.૦૭.૨૦૨૪ જના સ્મોલ ફાયનાન્સ બેંક લીમીટેડ વતી

જના સ્મોલ ફાયનાન્સ બેંક <u>(શિક્ચુલ્ક કોમસિંચલ બેંક)</u> <u>રજીસ્ટર્ડ ઓફીસ:</u> દા ફેરવે, ગ્રાઉન્ડ અને પહેલો માળ, સર્વે નં.૧૦/૧,૧૧/૨ અને ૧૨/૨બી, ઓફ ડોમલુર, કોરમંગલા ઇનર રીંગ રોડ, ઇજીએલ બિઝનેશ પાર્ક પછી, ચલાઘટ્ટા, બેંગ્લોર-૫૬૦૦૭૧. <u>રીજનલ બ્રાન્ચ ઓફીસ</u>:૨૦૮ થી ૨૧૩, બીજો માળ, સાંગરીલા આર્કેડ,

સારસ્વત બેંક ઉપર, ૧૦૦ ફુટ આનંદનગર રોડ, શ્ચામલ, અમદાવાદ, ગુજરાત–૩૮૦૦૧૫

AXIS BANK

**રીટેલ લેન્ડીંગ એન્ડ પેમેન્ટ ગુપ (લોકર શાખા / શાખા) :** એકિસસ બેંક લિમીટેડ, કલેકશન સેન્ટર, પહેલો માળ, યુનિટ નં. ૧૦૧ અને ૧૦૨ (ભાગ), બાલેશ્વર એવન્યુ, એસ.જી. હાઈવે, રાજપથ કલબની સામે, બોડકદેવ, અમદાવાદ, ગુજરાત -૩૮૦૦૫૪. **એકિસસ બેંક લિમીટેડ :** ત્રીજો માળ, ગીગા પ્લેકસ, એનપીસી-૧, ટીટીસી ઈન્ડસ્ટ્રીયલ એરીયા, મુગલસન રોડ, એરોલી, નવી મુંબઈ-૪૦૦૭૦૮. **૨જીસ્ટર્ડ ઓકિસ :** ત્રિશલ, ત્રીજો માળ, સમર્થેશ્વર મંદિરની સામે. લો ગાર્ડન, એલીસબ્રીજ. અમદાવાદ - ૩૮૦૦૦૬.

#### સ્થાવર મિલકતના વેચાણ માટે ઈ-હરાજી વેચાણ નોટીસ

સિકયોરીટાઈએશન એન્ડ રીકન્સ્ટ્રકશન ઓફ ફાઈનાન્શિયલ એસેટ્સ એન્ડ એન્ફોર્સમેન્ટ ઓફ સિકયોરીટી ઈન્ટરેસ્ટ એકટ - ૨૦૦૨ હેઠળ સ્થાવર મિલકતના વેચાણ માટેની ઈન્હરાજી વેચાણ નોટીસ સિકયોરીટી ઈન્ટરેસ્ટ (એન્ફોર્સમેન્ટ) નિયમ - ૨૦૦૨ ના નિયમ ૮(૬) ની જોગવાઈ સાંથે વંચાણે લેતાં.

આથી જાહેર જનતાને સામાન્ય રીતે અને ખાસ કરીને ઉધારકર્તાઓ અને જામીનદારોને સુચના આપવામાં આવે છે કે નીચે વર્ણવેલ સ્થાવર મિલકત સુરક્ષીત લેણદાર પાસે મોર્ગેજ/ચાર્જ કરવામાં આવી છે. જેનો પ્રત્યક્ષ કબજો (નીચે વિગતવાર તરીકે) અધિકૃત અધિકારી દ્વારા લેવામાં આવ્યો છે. "જેમ છે ત્યાં" "જેમ છે તેમ" અને "જે છે તે" અને "કોઈ આશ્રય આધાર નહીં" પર સિકયોર્ડ કેડીટરનું વેચાણ કરવામાં આવશે જેમાં તા. 28.08.2024 ના રોજ સવારે ૧૧.૦૦ થી બપોરે ૧૨ વાગ્યા સુધી, (નિરીક્ષણની તારીખ 16.08.2024 છે અને બીડ સબમીશન કરવાની છેલ્લી તારીખ અને સમય તા. 27.08.2024 ના રોજ સાંજે ૪.૦૦ વાગ્યા સુધી) નીચે દર્શાવેલ છે). સંબંધિત કોલમમાં નીચે જણાવ્યા પ્રમાણે મિલકતોની અનામત કિંમત અને કોંગ્રેમ અમે કોંગ્રેમ શ્રી ૧૧ કર્યા અમે કોંગ્રેમ તે ગઢમ

ક્ર. ન.	ઉધારકર્તા, મોર્ગેજરનું નામ અને શાખા	મિલકત / મકાનનું વર્ણન / આશરે કુલ વિસ્તાર	અનામત કિંમત	ઈએમડીની કિંમત	બીડ વધારવા ની રકમ	બાકી લ્હેણીની રકમ	સંપર્ક વ્યક્તિ
1	1. ખાંડેકર અશોકમહાદેવ (ઉધારકર્તા) 2. રેશ્મા અશોક ખાંડેકર (સહ- ઉધારકર્તા) (લોન એકાઉન્ટ નં. PHR001305495239)	તમામ ભાગ અને હિસ્સા સાથે ની રહેણાંક મિલકત નો ટાવર બી, બ્લોક-સી, ફ્લેટ નં.સી./ ૪૦૧, ચોથો માળ, સાકર સ્પ્લેન્ડોરા-ર, રેવન્યુ સર્વે નં.૩૮૫, બ્લોક નં.૨૨૭, ટી.પી.સ્કીમ નં.૧, ફાઇનલ પ્લોટ નં.૧૦૬, ગામ : વેમાલી, સમા સાવલી, વડોદરા-૩૯૦૦૦૮, ગુજરાત, ભારત. ચતુઃ સીમા - પૂર્વ : બાજુનો પ્લોટ, પશ્ચિમ : ૧૮.૦૦ મીટર પહોળો રોડ, ઉત્તરઃ સડક, દક્ષિણઃ બાજુનો પ્લોટ	રૂ. 1710000/- (રૂપિયા સત્તર લાખ દસ હજાર પુરા).	રૂ. 171000/- (રૂપિયા એક લાખ એકતેર હજાર પુરા).	રૂ. 15,000/- (રૂપિયા પંદર હજાર પુરા) ના ગુણાકારમાં	રૂ. 1578070/- (રૂપિયા પંદર લાખ ઇઠ્યોતેર હજાર સિત્તેર હજાર પુરા) ઉપરાંત ભવિષ્યનું વ્યાજ અને ચાર્જીસ તા.12-10-૨૦૨૩ થી લાગુ	નામ :- શ્રી ભાવિક પાદરીયા મોબાઇલ નંબર:- (+91) 9998003965 ઈ-મેઈલ ID:- Bhavik.Padariya@axisbank.com. અથવા નામ :- શ્રી ભાવેશ અગ્રવાલ મોબાઇલ નંબર:- (+91) 9828025286 ઈ-મેઈલ આઈડી:- bhawesh.agarwal@axisbank.co
2	1. અનિલ કુમાર વસરામભાઈ શ્રીમાળી (ઉધારકર્તા) 2. નીતાબેન અનિલકુમાર શ્રીમાળી (સહ-ઉધારકર્તા) (લોન એકાઉન્ટ નં. PHR013002669554)	તમામ ભાગ અને હિસ્સા સાથે ની રહેણાંક મિલકત નો પ્લોટ નં.૭૦, શ્યામ વિહાર ઉપવન, એસ ન. ૪૪૦ પૈકી, પરબડા રોડ, બનાસકાંઠા, પાલનપુર-૩૮૫૦૦૧, ગુજરાત, ભારત. ચતુઃ સીમા - પૂર્વ: આંતરિક માર્ગ, પશ્ચિમ: પ્લોટ નં. ૬૫, ઉત્તર : પ્લોટ નં. ૭૧, દક્ષિણ : પ્લોટ નં. ૬૯	રૂ. 2705800/- (રૂપિયા સત્તાવીસ લાખ પાંચ હજાર આઠસો પુરા).	રૂ. 270580/- (રૂપિયા બે લાખ સિત્તેર હજાર પાંચસો એંસી પુરા).	રૂ. 15,000/- (રૂપિયા પંદર હજાર પુરા) ના ગુણાકારમાં	રૂ. 1492081/- (રૂપિયા ચૌદ લાખ બાણું હજાર એક્યાસી પુરા) ઉપરાંત ભવિષ્યનું વ્યાજ અને શુલ્ક 07-12-2023 થી લાગુ.	નામ :- શ્રી આશિષકુમાર પટેલ મોબાઇલ નંબર:- (+91) 9925163262 ઈ-મેઈલ ID:- Ashishkumar2.Patel@axisbank.cor અથવા નામ :- શ્રી ભાવેશ અગ્રવાલ મોબાઇલ નંબર:- (+91) 9828025286 ઈ-મેઈલ આઈડી:- bhawesh.agarwal@axisbank.c
3	1. હિરેન વિનોદભાઈ અજમેરા (ઉધારકર્તા) 2. ગીતા હિરેનભાઈ અજમેરા (સહ-ઉધારકર્તા) (લોન એકાઉન્ટ નં. PHR044805337683)	ગુણધર્મ ૧:- તમામ ભાગ અને હિસ્સા સાથે ની રહેણાંક મિલકત નો ફ્લેટ નં.૩૦૨, ત્રીજો માળ, બ્લોક નં.બી., "શ્યામવિલા-૨" તરીકે ઓળખાતી ઇમારતમાં એનએ જમીન પર દ્દદ્દ૭૮ ચોરસ મીટર, રેવન્યુ સર્વે નં.૩૫૩/એ અને ૩૫૩/બી પર બાંધવામાં આવ્યો છે, જેની વધુ ઓળખ ટી.પી.એસ.નં.૧૦૧ (નિકોલ-કઠવાડા), એફ.પી.નં.૩૪, ગામ નિકોલ, સબ ડિસ્ટ્રકિટ અસારવા અમદાવાદ-૧૨ (નિકોલ) તરીકે ઓળખાય છે. ચતુઃ સીમા - પૂર્વઃ માર્જિન સ્પેસ પછી બ્લોક નં. એ, પશ્ચિમ: એક જ મિલકતનો માર્ગ કેટલાક ભાગમાં પસાર થવો અને કેટલાક ભાગમાં ક્લેટ નંબર 303, દક્ષિણ: આરક્ષણ પ્લોટ ગુણધર્મ ૨:- તમામ ભાગ અને હિસ્સા સાથે ની રહેણાંક મિલકત નો ફ્લેટ નં.૪૦૩, બિલ્ટ અપ એરિયા ૨૩૬ સ્કલેર યાર્ડ, ચોથો માળ, બ્લોક નં. એ, "શાંતિ પુજય હોમ્સ" તરીકે ઓળખાતી ઇમારતમાં, એનએ લેન્ડ એરિયા પર 10317 ચોરસ મીટર, રેવન્યુ સર્વે નં. 266 જે વધુ ઓળખાય છે તે ટી.પી.એસ. નંબર 45, એફ.પી. નંબર 80, પેટા ડિસના ચંદલોડિયા ગામ ચાંદલોડિયા તરીકે ઓળખાય છે. અમદાવાદ - 8 (સોલા), જિલ્લો અમદાવાદ, ગુજરાત. પૂર્વ : ક્લેટ નં. ૪૦૨, દક્ષિણ: બ્લોક નં. બી.	રૂ. 8389800/- (રૂપિયા ત્યાસી લાખ નેવ્યાસી હજાર આઠસો પુરા).	રૂ. 838980/- (રૂપિયા આઠ લાખ આડત્રીસ હજાર નવસો એંસી પુરા).	રૂ. 1,00,000/- (રૂપિયા એક લાખ પુરા) ના ગુણાકારમાં	રૂ. 4036171/- (રૂપિયા ચાલીસ લાખ છત્રીસ હજાર એકસો એકોતેર પુરા ) ઉપરાંત ભવિષ્યનું વ્યાજ અને ચાર્જીસ ૩૦-૦૪-૨૦૨૩ થી લાગુ.	નામ :- શ્રી મિશ્રા પ્રશાંત મોબાઇલ નંબર:- (+91) 9426162693 ઈ-મેઈલ ID:- mishra.jayshankar@axisbank.con અથવા નામ :- શ્રી ભાવેશ અગ્રવાલ મોબાઇલ નંબર:- (+91) 9828025286 ઈ-મેઈલ આઈડી:- bhawesh.agarwal@axisbank.c
4	1. શ્રી રજનીકાંત મોદી (ઉધારકર્તા) 2. શ્રીમતી વીણા રજનીકાંત મોદી (સહ-ઉધારકર્તા) (લોન એકાઉન્ટ નંબર LTR000305252822 & PHR044803663450)	ફ્લેટ નં. 503, પાંચમા માળે, બ્લોક / ટાવર નંબર "એફ", કાર્પેટ એરિયા ધરાવતો આશરે 49.95 ચોરસ મીટરનો વિસ્તાર ધરાવે છે અને બિલ્ટ-અપ એરિયા ધરાવે છે, જે "સાર્થક યુગ" તરીકે ઓળખાતી સ્કીમમાં આશરે 53.21 ચોરસ મીટરનો વિસ્તાર ધરાવે છે, જે બિનખેતીની જમીનમાં અવિભાજિત હિસ્સો ધરાવે છે, જે બિનખેતીની જમીન પર સ્થિત છે, બ્લોક નંબર 348, ટાઉન પ્લાનિંગ સ્કીમ નંબર 9, ટાઉન પ્લાનિંગ સ્કીમ નં. ફાઈનલ પ્લોટ નં.૬૮, મૌજેઃ તારાપુર, તાલુકોઃ ગાંધીનગર, ગાંધીનગર, નોંધણી જિલ્લા અને ગાંધીનગરના પેટા જિલ્લામાં. ચતુઃ સીમા - પૂર્વ : પ્લોટ નં.ગુડા, પશ્ચિમ : ફ્લેટ નં.એફ-૫૦૨, ઉત્તર : ફ્લેટ નં.ઇ-૫૦૩, દક્ષિણ: ફ્લેટ નં.એફ-૫૦૪	રૂ. 3812500/- (રૂપિયા આડત્રીસ લાખ બાર હજાર પાંચસો પુરા).	રૂ. 381250/- (રૂપિયા ત્રણ લાખ એક્યાસી હજાર બસો પચાસ પુરા).	રૂ. 15,000/- (રૂપિયા પંદર હજાર પુરા) ના ગુણાકારમાં	રૂ. 1885836/- (રૂપિયા અઢાર લાખ પંચ્યાસી હજાર આઠસો છત્રીસ પુરા) ઉપરાંત 28-02- 2023 થી શરૂ થતાં ભવિષ્યના વ્યાજ અને શુલ્ક.	નામ :- શ્રી મિશ્રા પ્રશાંત મોબાઇલ નંબર:- (+91) 9426162693 ઈ-મેઈલ ID:- mishra.jayshankar@axisbank.con અથવા નામ :- શ્રી ભાવેશ અગ્રવાલ મોબાઇલ નંબર:- (+91) 9828025286 ઈ-મેઈલ આઈડી:- bhawesh.agarwal@axisbank.c
5	1.જહેન્દ્રસિંહ આર યાદવ (ઉધારકર્તા) (લોન એકાઉન્ટ નં. PHR017500949215)	તમામ ભાગ અને હિસ્સા સાથે નો "ઓમ સાંઈરામ પાર્ક", જામનગર તાલુકો, જામનગર જિલ્લો, ગુજરાત સ્ટેટ સર્વે નં.૧-૧ બિન ખેતી ગામની સીમમાં ઢીંચ ૫ ગાખ ગામની સીમમાં, દર ૫૦ ચોરસ મીટરે કુલ મળીને ૫૯.૪૫ ચોરસ મીટરનો સબ પ્લોટ નં.૫૦/૨, જે પૈકીનો ૫૦/૨ નો સમાવેશ થાય છે, જેનું નામ જામનગરના સિંચડા ગામે બિનખેતીને સોંપવામાં આવ્યું છે. ચતુઃ સીમા - પૂર્વ : પ્લોટ નં.૭૪ અને ૭૫, પશ્ચિમઃ ૭.૫૦ મીટર રોડ, ઉત્તર : સબ પ્લોટ નં.૫૦/૧, દક્ષિણઃ સબ પ્લોટ નં.૫૦/૩	રૂ. 1198294/- (રૂપિયા અગિયાર લાખ અઠ્ઠાણુ હજાર બસો ચોરાણું પુરા).	રૂ. 119829.40/- (રૂપિયા એક લાખ ઓગણીસ હજાર આઠસો ઓગણત્રીસ અને યાલીસ પૈસા પુરા).		રૂ. 987265/- (રૂપિયા નવ લાખ સીત્યાસી હજાર બસો પાંસઠ પુરા ) વત્તા ભવિષ્યનું વ્યાજ અને ચાર્જીસ 12-09-2022 થી લાગુ	નામ :- શ્રી ગિરિરાજસિંહ એસ રાયજાદા મોબાઇલ નંબર:- (+91) 8980000108 ઈ-મેઈલ ID:- girirajsinh.rayjada@axisbank.con અથવા નામ :- શ્રી ભાવેશ અગ્રવાલ મોબાઇલ નંબર:- (+91) 9828025286 ઈ-મેઈલ આઈડી:- bhawesh.agarwal@axisbank.c
6	1. મીનલબેન ગોધાણી (ઉધારકર્તા) 2. અવનિશ ગોધાની (સહ- ઉધારકર્તા) (લોન એકાઉન્ટ નંબર LPR004701264221 & ECR004706461374)	તમામ ભાગ અને હિસ્સા સાથે ની સ્થાવર મિલકત નો ફ્લેટ નં. એ/801, સુપર બિલ્ટ-અપ એરિયા આશરે 1569.00 ચોરસ ફૂટ જેટલો છે, જે 145.81 ચોરસ મીટર જેટલો છે, 1411.20 ચોરસ ફૂટ જેટલો વિસ્તાર બિલ્ટ અપ એરિયા 131.15 ચોરસ મીટરની સમકક્ષ, કાર્પેટ એરિયા આશરે 1176.00 ચોરસ ફૂટ જેટલો 109.27 ચોરસ મીટર અને ફ્લેટ નં. A/901, સુપર બિલ્ટ અપ એરિયા આશરે 1481.00 ચોરસ ફૂટ જેટલો છે, જે 137.64 ચોરસ મીટર જેટલો છે, બિલ્ડ અપ એરિયા આશરે 1332.00 ચોરસ ફૂટ જેટલો છે, જે 103.12 ચોરસ મીટરની સમકક્ષ છે. આઠમા માળે, જમીન વિસ્તાર નીચે અવિભાજિત પ્રમાણસર હિસ્સો આશરે ૧૧૪.૫૩ ચોરસ મીટર, "રિવેરા એપાર્ટમેન્ટ", રેવન્યુ સર્વે નં.૧૪/૨/એ અને ૧૪/૨બી (ઓલ્ડ રેવન્યુ સર્વે નં. ૫૭/૨ અને ૫૮/૧), ટી.પી.એસ.નં. ૩ (રૂંઢ), એફ પી નં.૧, ગામ રંઘાઘ, પેટા જિલ્લો અને જિલ્લા સુરત પર બાંધવામાં આવેલ છે. ચતુઃ સીમા - પૂર્વઃ રોડ, પશ્ચિમ: ડો. રણછોડ દાસની સંપત્તિ, ઉત્તરઃ ખંડવલાની જમીન, દક્ષિણઃ સડક	રૂ. 11337408/- (રૂપિયા એક કરોડ તેર લાખ સાડત્રીસ હજાર ચારસો આઠ પુરા ).	રૂ. 1133740.8/- (રૂપિયા અગિયાર લાખ ત્રેત્રીસ હજાર સાતસો ચાલીસ અને એંસી પૈસા પુરા).	રૂ. 1,00,000/- (રૂપિયા એક લાખ પુરા) ના ગુણાકારમાં	રૂ.10862709/- (રૂપિયા એક કરોડ આઠ લાખ બાસઠ હજાર સાતસો નવ પુરા) ઉપરાંત 03-03-2023થી ભવિષ્યમાં વ્યાજ અને શુલ્ક.	નામ :- શ્રી મિશ્રા પ્રશાંત મોબાઇલ નંબર:- (+91) 9426162693 ઈ-મેઈલ ID:- mishra.jayshankar@axisbank.com. અથવા નામ :- શ્રી ભાવેશ અગ્રવાલ મોબાઇલ નંબર:- (+91) 9828025286 ઈ-મેઈલ આઈડી:- bhawesh.agarwal@axisbank.0
7	1. જાદવ ભરતકુમાર લાલજીભાઈ (ઉધારકર્તા) 2. હિનાબેન ભરતભાઈ જાદવ (સહ-ઉધારકર્તા) (લોન એકાઉન્ટ નં. PHR013003826529)	તમામ ભાગ અને હિસ્સા સાથે ની જમીન અને બિલ્ડીંગ નો પ્લોટ નં.૩ર, કચબે પાલનપુર રેવન્યુ સર્વે નં.૪૪૦ પાઇકી ૨, રહેણાંક જમીન, શ્યામવિહાર ઉપવન, પ્લોટ નં.૩૨, બિલ્ડ અપ એન્ડ માર્જિન ૬૪.૨૦ સ્કવેર મીટર ૭૪.૫૧ ચોરસ મીટર, ગ્રાઉન્ડ ફલોર અને પ્રથમ માળ, સુપર બિલ્ડ અપ એરિયામાં મિલકતનું નિર્માણ થાય છે. પેટા-જિલ્લો: પાલનપુર, જિલ્લો બનાસકાંઠા. ચતુઃ સીમા - પૂર્વ: પ્લોટ નં.૧૭, પશ્ચિમ: આંતરિક માર્ગ, ઉત્તર: આંતરિક માર્ગ, દક્ષિણ: પ્લોટ નં. ૩૧	રૂ. 2734300/- (રૂપિયા સત્તાવીસ લાખ ચોત્રીસ હજાર ત્રણસો પુરા).	રૂ. 273430/- (રૂપિયા બે લાખ તોત્તેર હજાર ચારસો ત્રીસ પુરા).	રૂ. 15,000/- (રૂપિયા પંદર હજાર પુરા) ના ગુણાકારમાં	રૂ. 1865763/- (રૂપિયા અઢાર લાખ પાંસઠ હજાર સાતસો ત્રેસઠ પુરા) વત્તા ૧૨-૦૯-૨૦૨૨ થી અમલમાં આવે તે રીતે ભવિષ્યનું વ્યાજ અને શુલ્ક.	નામ :- શ્રી આશિષકુમાર પટેલ મોબાઇલ નંબર:- (+91) 9925163262 ઈ-મેઈલ ID:- Ashishkumar2.Patel@axisbank.co અથવા નામ :- શ્રી ભાવેશ અગ્રવાલ મોબાઇલ નંબર:- (+91) 9828025286 ઈ-મેઈલ આઈડી:- bhawesh.agarwal@axisbank.
8	1. ધોબી સુધીરભાઈ ચંદ્રકાન્તભાઈ (ઉધારકર્તા) 2. હેમાબેન રતિલાલભાઈ ધોબી (સહ-ઉધારકર્તા) (લોન એકાઉન્ટ નં. PHR001305350121)	તમામ ભાગ અને હિસ્સા સાથે ની રહેણાંક મિલકત નો ફ્લેટ નં.૨૦૧, બીજો માળ, ટાવર બી, ગણધીશ સંકુલ, આર એસ નં.૮૬૨, ટી.પી.એસ.નં.૩, એફપી નં.૯૭૯, વી.એમ.એમ.એસ.નિગમ વોર્ડ નં.૩-સીની સામે, મહેશ કોમ્પલેક્ષની પાછળ, વાઘોડિયા, મૌજે : બાપોદ, વડોદરા-૩૯૦૦૧૯, ગુજરાત, ભારત. ચતુઃ સીમા - પૂર્વ : ફ્લેટ નંબર બી-૨૦૨, પશ્ચિમ : ઓ.ટી.એસ., ઉત્તર : કોમન પાર્કિંગ, દક્ષિણ : કોમન પેસેજ	રૂ. 1333200/- (રૂપિયા તેર લાખ	. 133320/- (રૂપિયા એક લાખ તેત્રીસ હજાર ત્રણસો વીસ પુરા).	રૂ. 15,000/- (રૂપિયા પંદર હજાર પુરા) ના ગુણાકારમાં	રૂ. 1362079/- (રૂપિયા તેર લાખ બાસઠ હજાર ઓગણાએંસી પુરા) વત્તા ભવિષ્યનું વ્યાજ અને ચાર્જીસ 12-10-2023 થી લાગુ.	નામ :- શ્રી ભાવિક પાદરીયા મોબાઇલ નંબર:- (+91) 9998003965 ઈ-મેઈલ ID :- Bhavik.Padariya@axisbank.con અથવા નામ :- શ્રી ભાવેશ અગ્રવાલ મોબાઇલ નંબર:- (+91) 9828025286 ઈ-મેઈલ આઈડી:- bhawesh.agarwal@axisbank.
9	1. આશિષ ભરતકુમાર કુકડિયા (ઉધારકર્તા) 2. કુકડિયા અંજાણી આશિષભાઈ (સહ-ઉધારકર્તા) (લોન એકાઉન્ટ નં. PHR008704563568)	તમામ ભાગ અને હિસ્સા સાથે ની "ડ્રીમ વીલી" તરીકે ઓળખાતી સ્થાવર મિલકત, રેવન્યુ સર્વે નં.૨૨/૧, પ્લોટ નં.૧૪ થી ૨૯, ફલેટ નં.ઇ-૧૦૦૩, ૧૦મો માળ, વિસ્તાર કુલ મળીને આશરે ૭૭.૫૨ ચોરસ મીટર, મોજે જામનગર શહેર. ચતુઃ સીમા - પૂર્વઃ 9 મીટર રોડ, પશ્ચિમ: પેસેજ અને લિફ્ટ, ઉત્તરઃ ફ્લેટ નંબર ૧૦૦૨, દક્ષિણ: માર્જિન	(રાપયા સત્તાવાસ લાખ પાંત્રીસ હજાર પાંચસો પુરા).	રૂ. 273550/- (રૂપિયા બે લાખ તોત્તેર હજાર પાંચસો પચાસ પુરા).	રૂ. 15,000/- (રૂપિયા પંદર હજાર પુરા) ના ગુણાકારમાં	રૂ. 2474001/- (રૂપિયા ચોવીસ લાખ ચુમોત્તેર હજાર એક પુરા) વત્તા ભવિષ્યનું વ્યાજ અને શુલ્ક 18-01-2023 થી લાગુ	નામ :- શ્રી ગિરિરાજસિંહ એસ રાયજાદા મોબાઇલ નંબર:- (+91) 8980000108 ઈ-મેઈલ ID:- girirajsinh.rayjada@axisbank.coi અથવા નામ :- શ્રી ભાવેશ અગ્રવાલ મોબાઇલ નંબર:- (+91) 9828025286 ઈ-મેઈલ આઈડી:- bhawesh.agarwal@axisbank.
10	1. બલદેવ કાંતિલાલ પાટડિયા (ઉધારકર્તા) 2. ક્રિષ્નાબેન બળદેવભાઈ પાટડિયા (સહ-ઉધારકર્તા) 3. રાજેશ મનસુખલાલ વધવન (સહ-ઉધારકર્તા) (લોન એકાઉન્ટ નં. PCR004704441041)	તમામ ભાગ અને હિસ્સા સાથે ની જમીન અને બિલ્ડીંગ ની શોપ નં. 403 (મંજૂરી યોજના ની દુકાન નંબર 4 : 03 મુજબ), સુપર બિલ્ટ અપ એરિયા 110.04 ચોરસ મીટરને સમકક્ષ આશરે 1184.00 ચોરસ ફૂટ જેટલો, તેનો બિલ્ટ અપ એરિયા આશરે 630.46 ચોરસ ફૂટ જેટલો છે, જે 58.59 ચોરસ મીટરની સમકક્ષ છે, ચોથો માળ, અને નીચેની જમીનમાં અવિભાજિત પ્રમાણસર હિસ્સો સાથે "રાજ ગેલેક્સી", મહેસૂલ સર્વેક્ષણ: 90, બ્લોક નં. ૧૪૨ જાહેરાત આશરે ૨૯૩૪ ૦૦ ચોરસ મીટર, ટી.પી. યોજના નં.: ૯ [પલણપોર-ભેસાણ], ફાઇનલ પ્લોટ નં. ૮૪ આશરે ૨૦૫૫.૦૦ ચોરસ મીટર, ગામ : પાલણપોર, પેટા જિલ્લો : શહેર, જિલ્લો સુરત. ચતુઃ સીમા - પૂર્વ : અડીને આવેલો ૧૮ મીટરનો સડકમાર્ગ, ઉત્તર : અડીને આવેલા આખરી પ્લોટ નં. ૭૭, પશ્ચિમ : રહેણાંક પ્લોટ માટે બાજુમાં આવેલું એસ.એમ.સી.નું વેચાણ, દક્ષિણ : બાજુમાં જ આવેલા એફ.પી.નં. ૮૩૩	રૂ. 3936800/- (રૂપિયા ઓગણચાલીસ લાખ છત્રીસ હજાર આઠસો પુરા).	રૂ. 393680/- (રૂપિયા ત્રણ લાખ તાણું હજાર છસો એંસી પુરા).	રૂ. 15,000/- (રૂપિયા પંદર હજાર પુરા) ના ગુણાકારમાં	રૂ. 2353084/- (રૂપિયા ત્રેવીસ લાખ ત્રેપન હજાર ચોર્યાસી પુરા) ઉપરાંત ૧૦-૦૫-૨૦૨૩થી શરૂ થયેલું ભવિષ્યનું વ્યાજ અને શુલ્ક.	નામ :- શ્રી મિશ્રા પ્રશાંત મોબાઇલ નંબર:- (+91) 9426162693 ઈ-મેઈલ ID :- mishra.jayshankar@axisbank.co અથવા નામ :- શ્રી ભાવેશ અગ્રવાલ મોબાઇલ નંબર:- (+91) 9828025286 ઈ-મેઈલ આઈડી:- bhawesh.agarwal@axisbank.
11	1. હરસુખભાઈ નારણભાઈ છાયા (ઉધારકર્તા) 2. દિનેશભાઈ નારણભાઈ છાયા (સહ-ઉધારકર્તા) (લોન એકાઉન્ટ નં. PHR004701171045)	તમામ ભાગ અને હિસ્સા સાથે ની રહેણાંક મિલકત નો ફ્લેટ નં. 304, વિસ્તાર 92.38 યોરસ મીટર (સુપર બિલ્ટ અપ એરિયા) અને 60.04 યોરસ મીટર (બિલ્ટ અપ એરિયા), ત્રીજો માળ, બિલ્ડિંગ નં. એચ, "ભક્તિધર રેસિડેન્સી-2" તરીકે ઓળખાતી ઇમારત અને એનએ લેન્ડ એરિયા પર બાંધવામાં આવેલા 38.13 ચોરસ મીટર જમીન વિસ્તારનો અવિભાજિત હિસ્સો ફાળવ્યો હતો, જે 15 ચોરસ મીટર, મહેસૂલ સર્વેક્ષણ નં. 54, બ્લોક નં. 128, બ્લોક નં. 128, ગામ સાયણ, પેટા જિલ્લો ઓલપાડ, જિલ્લો સુરત, ગુજરાત. ચતુઃ સીમા - પૂર્વઃ બિલ્ડિંગ નંબર - જી, પશ્ચિમ: ફ્લેટ નં.એચ - 303, ઉત્તર: અડીને આવેલા રેસિડેન્સી રોડ,	રૂ. 894600/- (રૂપિયા આઠ લાખ ચોરાણું હજાર	રૂ. 89460/- (રૂપિયા નેવ્યાસી હજાર ચારસો સાઠ પુરા).	રૂ. 15,000/- (રૂપિયા પંદર હજાર પુરા) ના ગુણાકારમાં	રૂ. 719595/- (રૂપિયા સાત લાખ ઓગણીસ હજાર પાંચસો પંચાણું પુરા) ઉપરાંત 10-03-2023 થી શરૂ થતાં ભવિષ્યના વ્યાજ અને ચાર્જિસ.	નામ :- શ્રી મિશ્રા પ્રશાંત મોબાઇલ નંબર:- (+91) 9426162693 ઈ-મેઈલ ID :- mishra.jayshankar@axisbank.co અથવા નામ :- શ્રી ભાવેશ અગ્રવાલ મોબાઇલ નંબર:- (+91) 9828025286 ઈ-મેઈલ આઈડી:- bhawesh.agarwal@axisbank.
12	1. મેસર્સ એમેરાલ્ડ કાર્સ પ્રાઈવેટ લિમિટેડ (ઉધારકર્તા) 2. કનૈયો એમ. ઠક્કર (ડાયરેક્ટર/ જમીનદાર/ગિરવેદાર) 3. ખુશી કનૈયો ઠક્કર (ડાયરેક્ટર/ જમીનદાર) (લોન એકાઉન્ટ નં. 918030058325934	કનૈયો મનહરલાલ ઠક્કર ની તમામ ભાગ અને હિસ્સા સાથે ની રહેણાંક મિલકત નો ફલેટ નં.૮૦૧, ૨૧૭ ચોરસ યાર્ડ (સુપર બિલ્ટ અપ એરિયા), આઠ માળ, "નિર્મલ શાંતિ ટાવર યોજના-એ" તરીકે ઓળખાતી યોજના, શ્રીશાંતિ ઓનર્સ એસોસિએશન, ફાઇનલ પ્લોટ નં.૨૧૫/ પાઇકી, ટાઉન પ્લાનિંગ સ્કીમ નં.૧/એસ, રેવન્યુ સર્વે નં.૩૩૩/પી, મૌજે બોડકદેવ, તાલુકા ઘાટલોડિયા, જિલ્લો અમદાવાદ. યતુઃ સીમા - ઉત્તર : અન્ય સંપત્તિ, દક્ષિણ : ખુલ્લી જગ્યા, પૂર્વ : પેસેજ એરિયા, પશ્ચિમ : ખુલ્લી જગ્યા	રૂ. 91,00,000 /- (રૂપિયા એકાણું	રૂ. 9,10,000/- (રૂપિયા નવ લાખ દસ હજાર પુરા)	રૂ. 1,00,000/- (રૂપિયા એક લાખ પુરા) ના ગુણાકારમાં	રૂ. 84,25,995.42/- (રૂપિયા ચોર્યાસી લાખ પચીસ હજાર નવસો પંચાણું અને બેતાળીસ પૈસા પુરા) ઉપરાંત ભવિષ્યનું વ્યાજ અને ચાર્જીસ 26-11- 2021 થી લાગુ (આ રકમમાં 31-04-2021 સુધી લાગુ વ્યાજ)	નામ :- શ્રી મનદીપ સિંહ ચાંડોક મોબાઇલ નંબર :- (+91) 9582926655 ઈ-મેઈલ ID:- mandeepsingh.chandoak@axisbank.com.

વેચાણના વિસ્તૃત નિયમો અને શરતો માટે, કૃપા કરીને તેમના વેબ પોર્ટલ પર સુરક્ષિત લેણદારની વેબસાઇટ એટલે કે https://www.axisbank.com/auction-retail અને બેંકની માન્ય સેવા પ્રદાતા મેસર્સ સી1 ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડમાં પૂરી પાડવામાં આવેલી લિંકનો સંદર્ભ લો https://www.bankeauctions.com


આ હરાજી બેંકની માન્ય સેવા પ્રદાતા મેસર્સ સી1 ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ મારફતે તેમના વેબ પોર્ટલ https://www.bankeauctions.com પર ઓનલાઇન હાથ ધરવામાં આવશે. એ પણ નોંધો કે ઉપરોક્ત વેચાણ ડેટ રિકવરી ટ્રિબ્યુનલ સમક્ષ દાખલ કરવામાં આવેલી સિક્યુરિટાઇઝેશન એપ્લિકેશનના પરિણામને આધિન છે, જો કોઈ હોય તો.

અન્ય કોઈ પણ સહાય માટે, ઇચ્છુક બિડર્સ સવારે 11:30 થી બપોરે 3:00 વાગ્યા ની વચ્ચે અધિકૃત અધિકારીઓની નીચે સંપર્ક કરી શકે છે. બિડ ટ્રાન્સફરેબલ નથી. આ નોટિસને સુરક્ષા હિત (અમલ બજવણી) નિયમ, 2002 ના નિયમ 8(6) હેઠળ ઋણલેનારાઓને 30 દિવસની નોટિસ તરીકે ધ્યાનમાં લેવી જોઈએ.

તારીખ: 20-07-2024 , સ્થળ : અમદાવાદ, ગુજરાત

નોંધ : (વિવાદ ની સ્થિતીમાં અંગ્રેજી આવૃતિને માન્ય રાખવામાં આવશે)

અધિકૃત અધિકારી, એક્સિસ બેંક લિ.



The Indian Express. For the Indian Intelligent. ♦ The Indian EXPRESS